

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April-2024 (OLD COURSE)
CORPORATE TAX PLANING -2(DSE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	લિક્વિડેશનનાં સમયે મિલકતોની વહેંચણીનાં સંદર્ભમાં કોર્પોરેટ ટેક્ષ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૧	કામદારોનાં મહેનતાણાનાં સંદર્ભમાં કોર્પોરેટ ટેક્ષ પ્લાનીંગ ઉદાહરણ સાથે સમજાવો.	(૨૦)
પ્રશ્ન.૨	વીમા વળતરની રીસીપ્ટ સંદર્ભમાં ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્ષ પ્લાનીંગ સમજાવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૨	વૈજ્ઞાનિક સંશોધન મિલકતોનાં વેચાણનાં સંદર્ભમાં ઉદાહરણ સાથે કોર્પોરેટ ટેક્ષ પ્લાનીંગ સમજાવો.	(૨૦)
પ્રશ્ન.૩	સમજાવો. (૧) એડવાન્સ ટુલીગ્સ	(૦૮)
	(૨) ડબલ ટેક્ષેશન રિલિફ	(૦૭)
	અથવા	
પ્રશ્ન.૩	ફેરબદલી કિંમત નિર્ધારણ નિયમન જોગવાઈ વિશે સમજાવો.	(૧૫)
પ્રશ્ન.૪	વિસર્જનનાં સંદર્ભ સાથે કોર્પોરેટ ટેક્ષ પ્લાનીંગ સમજાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	શાસક અને ગૌણ કંપનીઓ સાથે મિલકતોની ફેરબદલી વિશે સમજાવો.	(૧૫)

ENGLISH VERSION

Que.1	Explain corporate tax planning with reference to distribution of assets at the time of liquidation with example.	(20)
	OR	
Que.1	Explain corporate tax planning with reference to employees remuneration with example.	(20)
Que.2	Explain corporate tax planning with reference to receipt of insurance compensation with example.	(20)
	OR	
Que.2	Explain corporate tax planning with reference to sale of scientific research assets with example.	(20)
Que.3	Explain. (1) Advance rulings.	(08)
	(2) Double taxation relief.	(07)
	OR	
Que.3	Explain about provisions regulation transfer pricing.	(15)
Que.4	Explain corporate tax planning with reference of Demerger.	(15)
	OR	
Que.4	Explain about transfer of assets between holding and subsidiary companies.	(15)
